

-: અખબારી યાદી:-

“વન વીક, વન રોડ” ઝુંબેશ

સેન્ટ્રલ ઝોનમાં પેલેસ રોડ ખાતે વિવિધ શાખા દ્વારા કામગીરી હાથ ધરાઈ:

તારીખ: ૧૩-૦૧-૨૦૨૨

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્ય ૪૮ માર્ગો પર “વન વીક, વન રોડ” ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં આજે તા. ૧૩-૦૧-૨૦૨૨ના રોજ સેન્ટ્રલ ઝોનમાં પેલેસ રોડ ખાતે અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફૂટપાથ અને રોડ સમારકામ, હંગામી ધોરણે અનઅધિકૃત દબાણ હટાવવું, ગેરકાયદેસર દબાણ પર ડિમોલીશનની કામગીરી, રોડનું સ્પ્રેકચર સરખું કરવું, ફૂડ શાખા દ્વારા ચકાસણી, નડતરરૂપ ઝાડને ટ્રીમીંગ કરવું, વેરા વસુલાત શાખા દ્વારા સ્થળ પર જ ટેક્સ વસુલાત કરવી, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા જાહેરમાં કચરો ફેલાવતા / કચરાપેટી ન રાખતા / પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ કરતા આસામીઓ સામે દંડની કાર્યવાહી કરેલ અને રોડ સારો દેખાય તે પ્રકારે કામગીરી કરવામાં આવે છે.

(ટાઉન પ્લાનિંગ શાખાની કામગીરી)

વન વીક વન રોડ અંતર્ગત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારના વોર્ડ નં.૭ માં સમાવિષ્ટ પેલેસ રોડ પર ફૂટપાથ, એલ.ઓ.પી., માર્જિન તથા રોડ માં થયેલ નીચેની વિગતેના દબાણો /ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે કુલ ૨૨ સ્થળોએ દબાણ દુર કરી અંદાજે ૫૭૦૦ ચો. ફૂટ પાર્કિંગ/રસ્તા પૈકીની જગ્યા ખુલ્લી કરાવવામાં આવેલ છે

(૧) લક્ષ્મી જ્વેલર્સ, (૨) સોનલ જ્વેલર્સ, (૩) રૂપ જ્વેલર્સ, (૪) ધાર્મિક જ્વેલર્સ, (૫) વ્રજેશ્વર જ્વેલર્સ, (૬) ભુમી જ્વેલર્સ, (૭) હર્ષદ જ્વેલર્સ, (૮) શ્રી રાધે જ્વેલર્સ, (૯) એફ. એમ. યશ્માલાલા, (૧૦) એમ. ખીમજી જ્વેલર્સ, (૧૧) મણીદીપ જ્વેલર્સ, (૧૨) વૃજલાલ ખુશાલદાસ જ્વેલર્સ, (૧૩) સોહન જ્વેલર્સ, (૧૪) બાલકિશ્ના જ્વેલર્સ, (૧૫) શ્રી રામ જ્વેલર્સ, (૧૬) રારા જ્વેલર્સ, (૧૭) મનોજકુમાર ખુશાલદાસ જ્વેલર્સ, (૧૮) જયંતભાઈ ખુશાલદાસ જ્વેલર્સ, (૧૯) જયદીપ જ્વેલર્સ, (૨૦) રાજશ્રંગી કોમ્પ્લેક્સ, (૨૧) જીજ્ઞેશ જ્વેલર્સ અને (૨૨) મધુરમ જ્વેલર્સ ખાતેથી નડતરરૂપ સાઈન બોર્ડ દુર કરવામાં આવેલ છે.

(ફૂડ શાખાની કામગીરી)

- વન વીક વન રોડ અંતર્ગત FSSAI-2006 અન્વયે પ્રિપેડ ફૂડ તથા ચીકી ના લેવાયેલ ૨ નમુના

- વન વીક વન રોડ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના પેલેસ રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૨૨ કુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન ૦૮ પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપેલ.

- નમુનાની કામગીરી -

કુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ મુજબ નમૂના લેવામાં આવેલ :-

- (૧) વેજીટેબલ મખ્ખનવાલા સબ્જ પ્રિપેડ (લુઝ) સ્થળ- ભગવતિ સેન્ડવિચ એન્ડ પીઝા પાર્લર - પેલેસ રોડ
- (૨) તલ ના લાડુ (લુઝ) સ્થળ- શ્રી રામ ચિકી સેન્ટર - પેલેસ રોડ

- ખાણી-પીણી ના ધંધાર્થિઓની ચકાસણીની વિગત :-

કુડ વિભાગ દ્વારા તા. ૧૩/૦૧/૨૦૨૨ ના રોજ શહેરના પેલેસ રોડ વિસ્તારમાં આવેલ (૧) કોલકત્તા સ્નેક્સ - લાયસન્સ બાબતે નોટીસ (૨) સોનુ પાન એન્ડ કોલ્ડ્રિંકસ લાયસન્સ બાબતે નોટીસ (૩) ઘનશ્યામ સ્ટોર્સ - લાયસન્સ બાબતે નોટીસ (૪) સદગુરુ મેડિઝોન - લાયસન્સ બાબતે નોટીસ (૫) પ્રધાનમંત્રી જનૌષધિ કેન્દ્ર - લાયસન્સ બાબતે નોટીસ (૬) શ્રી બજરંગ પાન હાઉસ - લાયસન્સ બાબતે નોટીસ (૭) શ્રી મોમઇ ડીલક્ષ પાન એન્ડ કોલ્ડ્રિંકસ - લાયસન્સ બાબતે નોટીસ (૮) અમૂલભાઇ ડાભી ટી સ્ટોલ - લાયસન્સ બાબતે નોટીસ (૯) શિયા મેડિકલ સ્ટોર - લાયસન્સ બાબતે નોટીસ આપેલ

તથા (૧૦) શ્રી રામ વિજય ડેરી ફાર્મ (૧૧) ભગવતિ સેન્ડવિચ એન્ડ પીઝા પાર્લર (૧૨) ડી જે એન્ટરપ્રાઇઝ- ઝેપોલી બેકર્સ (૧૩) ઓમ એન્ટરપ્રાઇઝ (મોજિનિસ) (૧૪) સંતોષ ડેરી ફાર્મ (૧૫) ઠા. નાનજી જેઠાલાલ (૧૬) ડી જે એન્ટરપ્રાઇઝ- ઝેપોલી બેકર્સ (૧૭) સંતોષ ડેરી ફાર્મ (૧૮) ખેતલા આપા ટી સ્ટોલ (૧૯) ચામુંડા કોલ્ડ્રિંકસ (૨૦) કેમડાઈઝ સ્ટોર્સ (૨૦) કિશન મેડિકલ સ્ટોર્સ (૨૨) મધુરમ મેડિકલ ની સ્થળ પર ચકાસણી કરેલ.

(સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની કામગીરી)

વન વીક વન રોડ અંતર્ગત પેલેસ રોડ પર જાહેરમાં કચરો ફેંકનાર / ગંદકી કરવા સબબ કુલ ૦૩ આસામીઓ પાસેથી રૂ. ૭૫૦/-, પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખવા / ઉપયોગ કરવા સબબ કુલ ૦૨ આસામીઓ પાસેથી રૂ. ૧,૦૦૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ,

(બાંધકામ/વોટરવર્કસ/ડ્રેનેજ શાખાની કામગીરી)

બાંધકામ/વોટરવર્કસ/ડ્રેનેજ શાખા સેન્ટ્રલ ઝોન પેલેસ રોડ વોર્ડ નં.૭ ,૧૪ દ્વારા વન વીક , વન રોડ અંતર્ગત આજે તા.૧૩/૦૧/૨૦૨૨ના રોજ સ્ટ્રોમ વોટર મેનહોલ સફાઇ સંખ્યા - ૦૩, ડ્રેનેજ મેન હોલ સફાઇ સંખ્યા- ૦, પાણીની વાલ્વ ચેમ્બર સફાઇ સંખ્યા - ૯, ફૂટપાથ રીપેરીંગ (ચો.મી.) ૦ , પેવીંગ બ્લોક રીપેરીંગ-(ચો.મી.) - ૦, રોડ રીપેરીંગ (ચો.મી.) - ૦, રબ્બીશ ઉપાડવાનુ કામ.(ધ.મી.) - ૯. વિગેરે કામગીરી કરવામા આવી હતી. હાલ કામગીરી ચાલી રહી છે.

(જન સંપર્ક અધિકારી)
રાજકોટ મહાનગરપાલિકા